



**Deep Energy
Resources Limited**

25th December, 2023

To,
**Corporate Relations Department
BSE Limited**
2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai-400 001.

To,
**Corporate Relations Department
National Stock Exchange of India Limited**
Exchange Plaza, Plot No. C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai – 400 051.

SCRIP CODE : 532760

SYMBOL: DEEPENR

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement for the upcoming NCLT Convened Meetings of Equity Shareholders and Unsecured Creditors of Deep Energy Resources Limited

In terms of the Order dated 08th November, 2023 passed in C.A.(CAA)/51(AHM) 2023 read with the Order dated 05th December, 2023 and Corrigendum Order dated 12th December, 2023 respectively passed in Comp. App./18(AHM) 2023 (**Order**) by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench, ('NCLT') Deep Energy Resources Limited ('Company') is convening a meetings of the Equity Shareholders and Unsecured Creditors of the Company on Monday, 29th January, 2024 at 10:00 A.M and 12:00 noon (IST) respectively through video-conferencing or other audio-visual means in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with applicable circulars and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 ('Meeting'), to consider and if thought fit, to approve, with or without modifications, the Scheme of arrangement between Deep Energy Resources Limited and Savla Oil and Gas Private Limited and Prabha Energy Private Limited and their respective shareholders and creditors under section 230 to 232 of the Companies Act, 2013. The Company is using the services of the Link Intime India Private Limited to provide to its equity shareholders and unsecured creditors the facility of remote e-voting prior to the Meeting and e-voting during the Meeting.

In this regards, please find enclosed herewith the copies of Newspaper advertisement published in Business Standard - English and Jai Hind – Gujarati on 25th December, 2023 inter-alia intimating about the proposed meetings of the Equity Shareholders and Unsecured Creditors of the Company.

The said copies of newspaper advertisement is also available on website of the Company i.e. www.deepenergy.ooo.

You are requested to take the same on your record.

Thanking You,
Yours faithfully,

For, Deep Energy Resources Limited


**Divyeshkumar Senjaliya
Company Secretary & Compliance Officer
Membership No.: A60456**



DEEP ENERGY RESOURCES LIMITED

(Formerly known as Deep Industries Limited)

Regd. Office Address : 12A & 14, Abhishree Corporate Park, Ambli-Bopal Road, Ambli, Ahmedabad-380 058.

Tel. : 02717-298510 Fax : +91 2717 298520 E-mail : info@deepenergy.ooo Website : www.deepenergy.ooo

CIN : L63090GJ1991PLC014833

PUBLIC NOTICE

That, Kishorbai Motibhai Sapolia, the owner of non-agricultural land bearing Revenue Survey No.161, Block No.175, after r/s-vy promulgation new Block No.104 measuring about 16,311 sq. mts. of village Aarak, which now bears Sheet No.NA499, City Survey Month No.NA104 of ward Aarak(Binkhethi), Sub-district Jalapore, District Navsari, is desirous of mortgaging the said property with my client Bank against various credit facilities obtained to be obtained. That the aforesaid owner has informed us that he has lost/misplaced the original title deed/s mentioned in belowmentioned Schedule and that he has not used said title deed/s as security for obtaining any financial assistance from anyone. That if any individual, firm, trust, bank, financial institution, government/ semi government organization or any other person have any objections/claims of whatsoever nature with regards to the above matter, such objections or claims should be raised in writing before me personally alongwith all the documentary evidences within 14 days of date of publication of this notice, failing which no objections or claims of whatsoever nature will be entertained.

Kevin R. Shah Advocate

DEEP ENERGY RESOURCES LIMITED
Regd. Office: 12A & 14, Abhishek Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058, Phone: 02717-298510, Fax: 02717-298520

COMPANY SCHEME APPLICATION NO. C.A.(CAI)/5(A)HM/2023
READ WITH COMP. APP./18(A)HM/2023
IN THE MATTER OF COMPOSITE SCHEME OF ARRANGEMENT AMONGST DEEP ENERGY RESOURCES LIMITED, SAVLA OIL AND GAS PRIVATE LIMITED AND PRABHA ENERGY PRIVATE LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS AND CREDITORS

Deep Energy Resources Limited
A company incorporated under the provisions of the Companies Act, 1956 and now deemed to be incorporated under the Companies Act, 2013, and having its C.I.N.: L62000GJ1991PLOT0433 and its registered office at 12A & 14, Abhishek Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058, Gujarat, India.

NOTICE TO THE EQUITY SHAREHOLDERS AND UNSECURED CREDITORS OF DEEP ENERGY RESOURCES LIMITED FOR THE UPCOMING NCLT CONVENED MEETING
An application under Section(s) 230 to 232 of the Companies Act, 2013 read with the Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016 was presented before the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ('Hon'ble Tribunal' or 'NCLT') for sanctioning the Scheme of arrangement amongst Deep Energy Resources Limited ('Company' or 'Transferor Company 1'), Savla Oil and Gas Private Limited ('SOGPL' or 'Transferor Company 2') and Prabha Energy Private Limited ('PEPL' or 'Transferor Company 3') and their respective shareholders and creditors under Section 230 to 232 of the Companies Act, 2013 and other applicable laws including the rules and regulations ('Scheme').

This is to inform you that the Hon'ble Tribunal vide Order dated November 8, 2023, passed in Company Scheme Application No. C.A.(CAI)/5(A)HM/2023 read with the order dated December 5, 2023, and December 12, 2023, passed in the Comp. App./18(A)HM/2023 ('Order'), has directed, inter alia, that a meeting of the equity shareholders and unsecured creditors of the Company be convened and held on Monday, January 29, 2024, via Online/Physical mode at Hotel Planet Landmark, 13911, Ambli-Bopal Road, Off S.G. Road, Nr. Ashok Vatika, Opp. Ekta Farm, Ahmedabad-380058, Gujarat ('Meeting') to consider and, if thought fit, approve with or without modification, the scheme.

Pursuant to the Order of the NCLT, the Company is convening the meeting of Equity Shareholders on Monday, January 29, 2024, at 10:00 AM (IST) and of Unsecured Creditors on Monday, January 29, 2024, at 12:00 PM (IST) respectively only through video-conferencing or audio-visual means ('VCO/VAM') mode in compliance with the provisions of the Companies Act, 2013 ('Act') read with the applicable general circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations') and Secretarial Standard on General Meetings as issued by the Institute of Company Secretaries of India ('SS-2').

The Company has considered Friday, December 01, 2023, as the cut-off date for sending the Notice of the Meetings to the Shareholders and unsecured creditors of the Company. The Company will serve the notice of the meetings to the equity shareholders whose name is recorded in the Register of Members maintained by the Company's Registrar and Transfer Agent or in the Register of Beneficial Owners maintained by Depositories as on the cut-off date and in case of unsecured creditors to those whose name appears in the books of accounts of the Company as on the cut-off date. In compliance with the provisions of the Order of the NCLT and the applicable MCA Circulars, the Notice of the NCLT convened Meetings along with the Statement and related Annexures will be sent through electronic means to the equity shareholders and unsecured creditors of the Company whose e-mail addresses are registered with the Company's Depository/ Depository Participant/ Registrar and Transfer Agent. The Notice, Statement and related Annexures will also be made available on the website of the Company at www.deepenergy.com, on the website of the stock exchanges where equity shares of the Company are listed i.e., BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com, and on the website of Link Intime India Private Limited (agency for providing the Remote e-voting facility) at investvote.linkintime.com.

The copy of the scheme, the explanatory statement regarding according to Section 230, and the proxy form shall be provided by the Company free of charge at the registered office of the Company. The above documents shall be provided within one day of any requisition being so made for the same by the equity shareholders/unsecured creditors of the Company on all working days at the registered office. Further, the Company shall send a physical copy of the Notice and related documents to those Members (mentioning their Folio No./ DP ID and Client ID.) and Unsecured Creditors who request the same at cs@deepenergy.com.

The detailed instructions with respect to the participation of Members and unsecured creditors at the NCLT convened meetings will be provided in the Notice convening the Meetings. Members and unsecured creditors attending the meeting through VCO/VAM shall be counted for the purpose of quorum in terms of Section 103 of the Companies Act, 2013. The Company will provide the facility of remote e-voting ('remote e-voting') prior to the meeting as well as e-voting during the meeting, using the services of Link Intime India Private Limited to all its members and unsecured creditors to cast their votes on the resolution to be set out in the Notice of NCLT convened meeting. Detailed procedures for remote e-voting and e-voting facilities will be provided in the Notice of the meeting.

The Equity Shareholders whose email IDs are not registered with the Company (RTA/Depository may register in the following manner:
a. For Physical shareholders: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to cs@deepenergy.com and ahmedabad@linkintime.com.
b. For Demat shareholders: Please update your email ID & mobile no. with your respective Depository Participant (DP).
c. Upon registration, the equity shareholders shall follow the necessary instructions for remote e-voting and e-voting at the time of the equity shareholder's meeting to be set out in the notice of the meeting.

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L651107N24PL009792
Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022



NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) (the loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPAs as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Table with columns: Sr. No., Loan Account No., Type of Loan, Name of borrowers and co-borrowers, Section 13(2) of the Act, Outstanding amount as per Notice, Property Address.

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contractual rate of interest therefrom from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings under section 13(2) and section 13(4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further, you are prohibited under Section 13(13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Date: 25.12.2023
Place: Gujarat
Authorized Officer: IDFC First Bank Limited and presently known as IDFC First Bank Limited

PUBLIC NOTICE FOR THE TRANSFER OF PLOT

By this public notice, to whom so ever it may be concern, that the immovable property bearing Shed No. C1-101 measuring area 881.00 sq.mts. along with construction thereon of Pandesara Industrial Area/Estate, organized/planned on the industrial land by the Gujarat Industrial Development Corporation together with undivided proportionate share underneath land of the said shed/plot was allotted by the Gujarat Industrial Development Corporation for the period of 99 years of lease Hold Rights, situated on the industrial land at village : Pandesara, Sub District : Udhna, District : Surat are originally belongs to Shree Industries - a partnership firm and the said firm is sole and absolute owner & possessor of the said plot/property. And from the partners of the said firm, one of partner named Thakorbhai Vallabhbaai Mistri who have 25 % share into the said firm, died on 11/11/2017 and his wife named Divyaben Thakorbhai Mistri, was also died on 08/10/2020. And as per the Pedigree Statement of Divyaben Thakorbhai Mistri, Thakorbhai Vallabhbaai Mistri and she i.e. Divyaben Thakorbhai Mistri were died child less but she has executed a notarized WILL, dated 28/09/1982 and as per the terms of the said will, her share into the said partnership firm of Shree Industries - a partnership firm has come into the part of her nephew Bhavin Vinodhbhai Mistri and Amended Partnership Deed for the same was also executed which was notarized on dated 06/01/2023 and amendment was also mutated into the records of Registrar of Firms with Form-F. The partners of the Shree Industries - a partnership firm has applied for the mutation of the aforesaid Amended Partnership Deed into the records of Gujarat Industrial Development Corporation on dated 04/12/2023. Hence, by this public notice, any person having any lease hold rights over the said plot/property or having any right title or interest in the above plot/property or having any objection regarding proposed transaction/ mutation, Then they may convey their written objection at following office address of Gujarat Industrial Development Corporation within 10 Days from the publication of this public notice together with the documentary proof evidences in original. If anybody fails to submit their objection within stipulated period, it may be treated that they may have waived off or right-off their rights over the said plot/property and after that GIDC will approved/allowed/confirmed the aforesaid mutation of Amended Partnership Deed into the records of Gujarat Industrial Development Corporation and after that any dispute will not be entertained which strictly note finally.

Through me
Gujarat Industrial Development Corporation
Office of the Regional Manager, First Floor, Fire Station Building, Plot No. 326 & 327, Bhatpore GIDC, Surat-394510.
Devang S. Mehta Advocate
Office : 310, Wood Square, L. P. Savani Road, Adajan, Surat-395009

PRABHA ENERGY PRIVATE LIMITED

CIN: U40102GJ2009PT0057716
Regd. Office: 12A, Abhishek Corporate Park, Opp Swagat BRIS Bus Stop, Ambli Bopal Road, Bopal, Ahmedabad - 380058, Gujarat, India.
Phone: 02717-298510, Fax: 02717-298520
E-mail: info@prabhaenergy.com, Website: www.prabhaenergy.com

COMPANY SCHEME APPLICATION NO. C.A.(CAI)/5(A)HM/2023

IN THE MATTER OF COMPOSITE SCHEME OF ARRANGEMENT AMONGST DEEP ENERGY RESOURCES LIMITED, SAVLA OIL AND GAS PRIVATE LIMITED AND PRABHA ENERGY PRIVATE LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS AND CREDITORS
Prabha Energy Private Limited
A company incorporated under the provisions of the Companies Act, 1956 and now deemed to be incorporated under the Companies Act, 2013, and having its C.I.N.: U40102GJ2009PT0057716 and its registered office at 12A, Abhishek Corporate Park, Opp Swagat BRIS Bus Stop, Ambli Bopal Road, Bopal, Ahmedabad - 380058, Gujarat, India.

NOTICE TO THE UNSECURED CREDITORS OF PRABHA ENERGY PRIVATE LIMITED FOR THE UPCOMING NCLT CONVENED MEETING

An application under Section(s) 230 to 232 of the Companies Act, 2013 read with the Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016 was presented before the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ('Hon'ble Tribunal' or 'NCLT') for sanctioning the Scheme of arrangement amongst Deep Energy Resources Limited ('DEPL' or 'Transferor Company 1'), Savla Oil and Gas Private Limited ('SOGPL' or 'Transferor Company 2') and Prabha Energy Private Limited ('Company' or 'Transferor Company 3') and their respective shareholders and creditors under Section 230 to 232 of the Companies Act, 2013 and other applicable laws including the rules and regulations ('Scheme'). This is to inform you that the Hon'ble Tribunal vide Order dated November 8, 2023, passed in Company Scheme Application No. C.A.(CAI)/5(A)HM/2023, read with the order dated December 5, 2023, and December 12, 2023, passed in the Comp. App./18(A)HM/2023 ('Order'), has directed, inter alia, that a meeting of the unsecured creditors of the Company be convened and held on Monday, January 29, 2024, via Online/Physical mode at Hotel Planet Landmark, 13911, Ambli-Bopal Road, Off S.G. Road, Nr. Ashok Vatika, Opp. Ekta Farm, Ahmedabad-380058, Gujarat ('Meeting') to consider and, if thought fit, approve with or without modification, the scheme.

Pursuant to the Order of the NCLT, the Company is convening the meeting of Unsecured Creditors on Monday, January 29, 2024, at 03:00 PM (IST) only through video-conferencing or other audio-visual means ('VCO/VAM') mode in compliance with the provisions of the Companies Act, 2013 ('Act') read with the applicable general circulars issued by the Ministry of Corporate Affairs and Secretarial Standard on General Meetings as issued by the Institute of Company Secretaries of India ('SS-2'). The Company has considered Friday, December 01, 2023 as the cut-off date for sending the Notice of the Meeting to the unsecured creditors of the Company. The Company will serve the notice of the meeting to the unsecured creditors whose name appears in the books of accounts of the Company as on the cut-off date. In compliance with the provisions of the Order of the NCLT and the applicable MCA Circulars, the Notice of the NCLT convened Meeting along with the Statement and related Annexures will be sent through electronic means to the unsecured creditors of the Company whose e-mail addresses are registered with the Company. The Notice, Statement and related Annexures will be also made available on the website of the Company www.prabhaenergy.com and also on the website of Link Intime India Private Limited (agency for providing the Remote e-voting facility) at investvote.linkintime.com.

The copy of the scheme, the explanatory statement regarding according to Section 230, and the proxy form shall be provided by the Company free of charge at the registered office of the Company. The above documents shall be provided within one day of any requisition being so made for the same by the equity shareholders/unsecured creditors of the Company on all working days at the registered office. Further, the Company shall send a physical copy of the Notice and related documents to those Members (mentioning their Folio No./ DP ID and Client ID.) and Unsecured Creditors who request the same at cs@deepenergy.com.

The detailed instructions with respect to the participation of Members and unsecured creditors at the NCLT convened meetings will be provided in the Notice convening the Meetings. Members and unsecured creditors attending the meeting through VCO/VAM shall be counted for the purpose of quorum in terms of Section 103 of the Companies Act, 2013. The Company will provide the facility of remote e-voting ('remote e-voting') prior to the meeting as well as e-voting during the meeting, using the service of Link Intime India Private Limited to all its unsecured creditors to cast their votes on the resolution to be set out in the Notice of NCLT convened meeting. Detailed procedures for remote e-voting and e-voting facilities will be provided in the Notice of the meeting.

The Unsecured Creditors whose email IDs are not registered with the Company may get their email IDs registered with the Company at info@prabhaenergy.com. Upon registration, the unsecured creditors shall follow the necessary instructions for remote e-voting and e-voting at the time of the meeting of unsecured creditors to be set out in the notice of the meeting.

For, Prabha Energy Private Limited
Rajasekhar V. K., Advocate, Chairman appointed for the meeting.
Date: December 25, 2023
Place: Ahmedabad

PUBLIC NOTICE

That, Jitendra Harijal Shah, Bhavna Jitendra Shah, Megheshkumar Govindji Mistry and Ramesh Govindji Mistry, the owners of non-agricultural land bearing Block No. 552 measuring about 13,841 sq. mts. of village Vesma, which now bears SHEET No.NA99, City Survey Month No.NA552 of ward Vesma(Binkhethi), Sub-district Jalapore, District Navsari, are desirous of mortgaging the said property with my client Bank against various credit facilities obtained to be obtained. That the aforesaid owners have informed us that they have lost/misplaced the original title deed/s mentioned in belowmentioned Schedule and that they have not used said title deed/s as security for obtaining any financial assistance from anyone. That if any individual, firm, trust, bank, financial institution, government/ semi government organization or any other person have any objections/claims of whatsoever nature with regards to the above matter, such objections or claims should be raised in writing before me personally alongwith all the documentary evidences within 14 days of date of publication of this notice, failing which no objections or claims of whatsoever nature will be entertained.

- Schedule - List of Original Documents Lost/Misplaced
1) Confirmation Deed registered in the office of Sub-registrar, Jalapore at serial no. 3166 dt.19/05/2022 alongwith its original registration receipt.
2) Confirmation Deed registered in the office of Sub-registrar, Jalapore at serial no. 4668 dt.28/09/2021 alongwith its original registration receipt.
3) Deed of Cancellation of Sale registered in the office of Sub-registrar, Jalapore at serial no. 4667 dt.28/09/2021 alongwith its original registration receipt.
4) Sale Deed registered in the office of Sub-registrar, Jalapore at serial no. 115 dt.07/01/2021 alongwith its original registration receipt.

Kevin R. Shah Advocate

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) | CIN : L651107N24PL009792
Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022



POSSESSION NOTICE (For Immovable Property)

Whereas the undersigned being the Authorized Officer of the IDFC FIRST Bank Limited (erstwhile IDFC First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18.07.2023 calling upon the borrower, co-borrowers and guarantors 1. Lochan Pradhan, 2. Puspabati Pradhan to repay the amount mentioned in the notice being Rs. 8,80,775.74 (Rupees Eight Lac Eighty Thousand Seven Hundred Seventy Five and Seventy Four Paise Only) as on 18.07.2023 within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 in this 19' day of December 2023. The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 8,80,775.74 (Rupees Eight Lac Eighty Thousand Seven Hundred Seventy Five and Seventy Four Paise Only) and interest thereon. The borrower's attention is invited to provisions of sub - Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable properties.
All that Piece And Parcel Of Plot No. B/109, Admeasuring As Per Site 52.05 Sq. Mtrs., As Per Passing Plan 52.05 Sq. Mtrs. Of 'Kanya Residency' Vihara 'B' Situated At R.S.No. 23/1, 23/2, 23/31, 23/32, 23/41, 23/42, Block No. 302/B Village: Mulad, Sub-District: Olpad, District: Surat, Gujarat-394110, And Bounded As: East: Adj. Plot No. 110, West: Adj. Plot No. 108, North: Adj. Plot No. 104, South: Society Road.
Date: 19' December 2023
Place: Surat
Loan Account No.: 4542282

IDFC FIRST Bank Limited
(erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited)
CIN : L651107N24PL009792
Registered Office: KRM Towers, 8' Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas the undersigned being the Authorized Officer of the IDFC FIRST Bank Limited (erstwhile IDFC FIRST Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 26.08.2023 calling upon the borrower, co-borrowers and guarantors 1. Senva Bharathali, 2. Senva Nayanaben, to repay the amount mentioned in the notice being Rs. 2,93,849.26 (Rupees Two Lac Ninety Three Thousand Eight Hundred Forty Nine and Twenty Six Paise Only) as on 22.08.2023, within 60 days from the date of receipt of the said Demand notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 in this 19' day of December 2023. The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC FIRST Bank Limited (erstwhile IDFC FIRST Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 2,93,849.26 (Rupees Two Lac Ninety Three Thousand Eight Hundred Forty Nine and Twenty Six Paise Only) and interest thereon. The borrower's attention is invited to provisions of sub - Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable properties
All that Piece And Parcel Of Immovable Property Being A Gram Panchayat Millat No. 23/1, Having Area Admeasuring 69.01 Sq. Meter, Situated On The Land Of Moje/Village: Shanpur, Taluka- Viramgam, District: Ahmedabad, Gujarat-382150, And Bounded As: East: Road, West: Farm Of Admarambhai Rajibhai, North : Farm Of Punjabhai Somnabhai, South: Property Of Ishwarbhai Fuljibhai.
Date: 19' December 2023
Place : Ahmedabad
Loan Account No : 88951381

Opinion, Insight Out

Opinion, Monday to Saturday
To book your copy, sms reachbs to 57575 or email order@bmail.in

Business Standard Insight Out

